

## સામાન્ય વારંવાર પૂછાતા પ્રશ્નો

સર્વેના સિંહાવલોકન અને તેમાંથી મળેલ નિષ્કર્ષોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તેના વિશે પ્રાથમિક માહિતી મેળવવા માટે કૃપા કરીને સહભાગી માહિતી પત્રિકા (Participant Information Sheet) જુઓ. આ પેજમાં સર્વે વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો સંબંધી કેટલીક વધુ માહિતી છે..

તમે આ સર્વે કેમ કરી રહ્યા છો?

અમે જાણવા માંગીએ છીએ કે કોવિડ-19 મહામારી અને લોકડાઉન ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સના મૂળવંશીય લઘુમતિના લોકોને કેવી રીતે પ્રભાવિત કરી રહ્યા છે. આ સર્વે વિસ્તૃત સામાન્ય જનતામાં પણ પૂછવામાં આવી રહ્યો છે, જેથી અમે લોકોના જુદા-જુદા સમૂહોના દૃષ્ટિકોણોને સમજી શકીએ.

આ સર્વે કોણ કરી રહ્યું છે?

એવિડન્સ ફોર ક્વોલિટી નેશનલ સર્વે એક સ્વતંત્ર સર્વે એજન્સી Ipsos MORI દ્વારા યુનિવર્સિટી ઓફ માન્યેસ્ટરના સેન્ટર ઓફ ડાયનેમિક્સ ઓફ એથનિસિટી વતીથી કરવામાં આવી રહ્યો છે.

CoDE એક ચાર વર્ષનો અનેક વિષયોના અભ્યાસનો સંશોધન માટેનો પ્રોગ્રામ છે જે મૂળવંશીય અસમાનતાઓ અને ઓળખોમાં થતા પરિવર્તનને સમજવા સાથે સંકળાયેલો છે. વધુ માહિતી માટે અહીં જાવ:

<https://www.cmi.manchester.ac.uk/research/projects/code/>

હું કેવી રીતે ભાગ લઈ શકું?

જો તમે મુખ્ય સર્વેમાં ભાગ લેવા માટે પાત્ર છો કે નહીં તે જોવા ઇચ્છતા હો, તો તમે નોંધણી સર્વે સુધી અહીં ક્લિક કરીને પહોંચી શકશો:

<https://surveys.ipsosinteractive.com/surveys/?p=jZt9VfdUz0lpKjKSVU19dx7XQuIvdp%2bHMIFDym5lOKg3UL40L4YcPmzT3ZhgS2XRRcsH3f9aYbvF9XZJqv9RXf%2f2dlVd2Xvs3qZdmM5qxS4%3d&id=partxtest>

શું મારા માટે ઓનલાઇન ભાગ લેવો ફરજિયાત છે?

ના, તમે ટેલિફોન પર 0808 1296800 પર કોલ કરીને તમને સામો ફોન કરવાનો સંદેશો મૂકીને પણ ભાગ લઈ શકો છો (આ મદદ પેજનો 'સંપર્ક' વિભાગ જુઓ).

હેલ્પલાઇનને કોલ કરવાનો કેટલો ખર્ચ થશે?

બધા જ હેલ્પલાઇન નંબર મફત છે.

શું મારા માટે બધા જ પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે?

આ પ્રશ્નોના જવાબ આપવા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, માટે તમારે તેમ કરવું ફરજિયાત નથી. અમે આશા રાખીએ છીએ કે તમે ભાગ લેશો, કારણ કે આ અને શ્રેષ્ઠ સંભવિત ચિત્ર પૂરું પાડશે. જો તમે જવાબ ન આપવાનું પસંદ

કરો, તો તમારી પાસે બધાજ જનસાંખ્યિકીય પ્રશ્નો માટે પસંદગી માટે “જવાબ નહીં આપવાનું પસંદ કરીશ” વિકલ્પ ઉપલબ્ધ હશે.

**શું હું કોઈ બીજી ભાષામાં સર્વે પૂરો કરી શકું?**

તમે આ સર્વેને 13 વૈકલ્પિક ભાષાઓમાં પણ પૂરો કરી શકો છો. તમારે સર્વેની શરૂઆતમાં તમારી પસંદગીની ભાષા પસંદ કરવાની રહેશે (કૃપા કરીને નોંધ લેશો કે શક્ય છે કે જુદી ભાષાઓમાં સર્વે તાત્કાલિક ઉપલબ્ધ ન હોય તેવું બની શકે છે). ટેલિફોન સર્વે પણ બીજી ભાષામાં પૂરો કરી શકાય છે. ભાષાના વિકલ્પોમાં અરબી, બંગાળી, ચાઇનીઝ, ગુજરાતી, પોલિશ, પોર્ટુગીઝ, પંજાબી: ગુરમુખી, પંજાબી: શાહમુખી, રોમાનિયન, સોમાલી, ટર્કિશ, ઉર્દૂ અને વેલ્શનો સમાવેશ થાય છે.

**હું મારું ગિફ્ટ વાઉચર કેવી રીતે ક્લેઇમ કરી શકું?**

તમે પૂર્ણ સર્વે પૂરો કરો, એટલે તમને આપોઆપ ગિફ્ટ વાઉચર મોકલવામાં આવશે. જો તમને તમારું વાઉચર સર્વે પૂરો કરવાના 2 અઠવાડિયાની અંદર ન મળે, તો કૃપા કરીને [epanel-uk@i-say.com](mailto:epanel-uk@i-say.com) નો સંપર્ક સાધો અને '20-089809-01 - EVENS survey voucher' નો સંદર્ભ આપો.

**હું સર્વેમાં પૂરો પાડું તે ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે?**

ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે અને ડેટા સંરક્ષણ પ્રક્રિયાઓ વિશે વધુ વિગતો માટે ભાગ લેનાર માટે માહિતી પત્રિકા (જે આ મદદ પેજ પર ઉપલબ્ધ છે) નો ઉપયોગ કરો.

**શું હું ઓનલાઇન સર્વે પૂરો કરતો/કરતી હોઉં તે દરમિયાન વચ્ચે વિરામ લઈ શકું?**

હા, ઓનલાઇન સર્વે પૂરો કરવા દરમિયાન, તમારી પ્રગતિ આપોઆપ સેવ થઈ જશે. તમે જ્યારે ઇચ્છો ત્યારે સર્વેની બ્રાઉઝર વિંડો બંધ કરી દઈ શકો છો - તમારી પ્રગતિ સેવ કરવામાં આવશે. જ્યારે તમે સર્વે ભરવાનું ચાલુ રાખવા તૈયાર હો, ત્યારે બસ તમને મોકલવામાં આવેલી લિંકનો ઉપયોગ કરીને સર્વે પેજ પર પાછા ફરો.

**મને મારો પોસ્ટકોડ અને જન્મતારીખ પૂરાં પાડવા કેમ કહેવામાં આવ્યું છે?**

આ ડેટા એ સુનિશ્ચિત કરવા માટે એકઠો કરવામાં આવે છે કે સંશોધન અનેક જુદા-જુદા લોકોના દૃષ્ટિકોણોનું પ્રતિનિધિત્વ કરે દા.ત. જુદી-જુદી ઉંમરના અને જુદા-જુદા ભૌગોલિક પ્રદેશોમાં રહેતા લોકો. જો તમારે આ પ્રશ્નો જવાબ ન આપવો હોય તો તે ફરજિયાત નથી.

સંશોધનના ઉદ્દેશ્ય અને ડેટાના ઉપયોગ સંબંધી વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને સહભાગી માહિતી પત્રિકા જુઓ. ડેટાની ગોપનીયતા વિશેની વધુ વિગતો પણ યુનિવર્સિટી ઓફ માન્યેસ્ટર ગોપનીયતા સૂચના અને Ipsos MORI ગોપનીયતા નીતિ પેજ પર મળી શકશે. Ipsos MORIના માહિતી પેજ પર જેના જવાબ અપાયા ન હોય તેવા વધારાના પ્રશ્નો માટે કૃપા કરી આમને ઈમેલ મોકલો:

[evenssurvey@ipsos-mori.com](mailto:evenssurvey@ipsos-mori.com)

